

To,
The Corporate Relations Department
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai – 400 001

Stovec Industries Ltd.

Regd. Office and Factory :
N.I.D.C., Near Lambha Village, Post Narol,
Ahmedabad - 382 405, INDIA

CIN : L45200GJ1973PLC050790

Telephone : +91 79 61572300
+91 79 25710407 to 410

Fax : +91 79 25710406

E-mail : admin@stovec.com

Reference : Scrip Code- 504959
Date : April 11, 2022
Subject : Newspaper Publication

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copy of newspaper publication for Notice of 48th Annual General Meeting, E-voting Information and Book Closure, published in Business Standard (English) and Jaihind (Gujarati) on Monday, April 11, 2022.

Kindly take the same on your record.

Thanking you,

Yours sincerely,
For Stovec Industries Limited,



Sanjeev Singh Sengar
Company Secretary & Compliance Officer

Encl: As above



AKC STEEL INDUSTRIES LIMITED

12.5 In the event Shareholder Broker(s) of Eligible Shareholder is not registered with BSE then that Eligible Shareholder can approach any BSE registered stock broker and make a bid by using quick unique client code (UCC) facility through that BSE registered stock broker after submitting the details as may be required by that stock broker to be in compliance with the SEBI regulations. In case Eligible Shareholder is not able to bid using quick UCC facility through any other BSE registered stock broker then the Eligible Shareholder may approach Company's Broker to bid by using quick UCC facility by submitting relevant documents.

12.6 The Eligible Shareholder approaching Designated Stock Exchange registered stock broker (with whom he does not have an account) may have to submit the requisite documents as may be required. The requirement of documents and procedures may vary from broker to broker.

12.7 During the tendering period, the order for selling the shares will be placed in the Acquisition Window by eligible shareholders through their respective stock brokers during normal trading hours of the secondary market. The stock brokers ("Seller Member(s)") can enter orders for demat shares and physical shares.

12.8 The reporting requirements for Non-Resident Shareholders under the Foreign Exchange Management Act, 1999, RBI, and any other rules, regulations, guidelines, for remittance of funds, shall be made by the Eligible Shareholder and/or the Shareholder Broker through which the Eligible Shareholder places the bid.

12.9 Procedure to be followed by Eligible Shareholders holding Equity shares in the dematerialized form:

- Shareholders who desire to tender their Equity Shares in the electronic form under the Buyback would have to do so through their respective Seller Member by indicating to their broker the details of Equity Shares they intend to tender under the Buyback.
- The Seller Member would be required to place an order/bid on behalf of the Shareholders who wish to tender Equity Shares in the Buyback using the acquisition window of the BSE. Before placing the bid, the concerned Seller Member would be required to transfer the tendered Equity Shares to the special account of Clearing Corporation of India Limited ("Clearing Corporation"), by using the settlement number and the procedure prescribed by the Clearing Corporation. This shall be validated at the time of order/bid entry.
- The details of the Special Account of Clearing Corporation shall be informed in the issue opening circular that will be issued by BSE Limited/Clearing Corporation.
- For Custodian Participant orders for demat Equity Shares early pay-in is mandatory prior to confirmation of order by custodian. The custodian shall either confirm or reject the orders not later than the closing of trading hours on the last day of the tendering period. Thereafter, all unconfirmed orders shall be deemed to be rejected. For all confirmed Custodian Participant orders, order modification shall revoke the custodian confirmation and the revised order shall be sent to the custodian again for confirmation.
- Upon placing the bid, the Seller Member shall provide a Transaction Registration Slip ("TRS") generated by the BSE Exchange Bidding System to the shareholder. TRS will contain the details of order submitted like Bid ID No., Application No., DP ID, Client ID, No. of Equity Shares tendered etc.
- It is clarified that in case of dematerialized Equity Shares, submission of the tender form and TRS is not mandatory. In case of non-receipt of the completed tender form and other documents, but receipt of Equity Shares in the accounts of the Clearing Corporation and a valid bid in the exchange bidding system, the bid by such Equity Shareholder shall be deemed to have been accepted.

12.10 Procedure to be followed by Eligible Shareholders holding Equity shares in the Physical form:

- In accordance with SEBI's circular dated July 31, 2020 (circular no. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/144), shareholders holding Equity Shares in physical form are allowed to tender such shares in a buyback undertaken through the tender offer route. However, such tendering shall be as per the provisions of the Buyback Regulations.
- Eligible Shareholders who are holding physical Equity Shares and intend to participate in the Buyback will be required to approach their respective Seller Member along with the complete set of documents for verification procedures to be carried out before placement of the bid. Such documents will include the (A) Tender Form duly signed by all Eligible Shareholders (in case shares are in joint names, in the same order in which they hold the shares), (B) original share certificate(s), (C) valid share transfer form(s)/Form SH-4 duly filled and signed by the transferors (i.e. by all registered Shareholders in the same order and as per the specimen signatures registered with the Company) and duly witnessed at the appropriate place authorizing the transfer in favour of the Company, (D) self-attested copy of PAN card(s) of all Eligible Shareholders, (E) any other relevant documents such as power of attorney, corporate authorization (including board resolution/specimen signature), notarized copy of death certificate and succession certificate or probated will, if the original shareholder is deceased, etc., as applicable. In addition, if the address of the Eligible Shareholder has undergone a change from the address registered in the register of members of the Company, the Eligible Shareholder would be required to submit a self-attested copy of address proof consisting of any one of the following documents: valid Aadhaar card, voter identity card or passport.
- Based on these documents, the concerned Seller Member shall place an order/bid on behalf of the Eligible Shareholders holding Equity Shares in physical form who wish to tender Equity Shares in the Buyback, using the acquisition window of the Designated Stock Exchange. Upon placing the bid, the Seller Member shall provide a TRS generated by the exchange bidding system to the Eligible Shareholder. TRS will contain the details of order submitted like folio no., certificate no., distinctive no., no. of Equity Shares tendered etc.
- Any Seller Member/Eligible Shareholder who places a bid for physical Equity Shares, is required to deliver the original share certificate and document (as mentioned above) along with TRS generated by exchange bidding system upon placing bid, either by registered post, speed post or courier or hand delivery to the Registrar to the Buyback i.e. Maheshwari Datamatics Pvt. Ltd. (at the address mentioned at paragraph 17 below) not later than 2 (two) days from the offer closing date. The envelope should be super scribed as "AKC Steel Industries Limited Buyback 2022". One copy of the TRS will be retained by Registrar to the Buyback and it will be duly acknowledged to the Seller Member.
- The Eligible Shareholders holding physical Equity Shares should note that physical Equity Shares will not be accepted unless the complete set of documents are submitted. Acceptance of the physical Equity Shares for Buyback by the Company shall be subject to verification as per the Buyback Regulations and any further directions issued in this regard. The Registrar to the Buyback will verify such bids based on the documents submitted on a daily basis and till such verification, the Designated Stock Exchange shall display such bids as 'unconfirmed physical bids'. Once Registrar to the Buyback confirms the bids, they will be treated as 'confirmed bids'.
- In case any Eligible Shareholder has submitted Equity Shares in physical form for dematerialization, such Eligible Shareholders should ensure that the process of getting the Equity Shares dematerialized is completed well in time so that they can participate in the Buyback before the closure of the tendering period of the Buyback.
- An unregistered shareholder holding Equity Shares in physical form may also tender their Equity Shares in the Buyback by submitting the duly executed transfer deed for transfer of shares, purchased prior to the Record Date, in their name, along with the offer form, copy of their PAN card and of the person from whom they have purchased shares and other relevant documents as required for transfer, if any.

- Modification/cancellation of orders will be allowed during the tendering period of the Buyback.
- The cumulative quantity tendered shall be made available on BSE Limited's website - www.bseindia.com throughout the trading session and will be updated at specific intervals during the tendering period.

13. METHOD OF SETTLEMENT:

Upon finalization of the basis of acceptance as per Buyback Regulations:

- The Settlement of trades shall be carried out in the manner similar to settlement of trades in the secondary market.
- The Company will pay the consideration to the Clearing Corporation on or before the pay-in date for settlement for Equity Shares accepted under the Buyback, the Shareholders whose shares have been accepted in the Buyback will receive funds payout in their settlement bank account from Clearing Corporation.
- The equity shares bought back in the demat form would be transferred directly to the demat account of the Company opened for Buyback (the "Special Demat Account") provided it is indicated by the Company's Broker or it will be transferred by the Company's Broker to the Special Demat Account on receipt of the equity shares from the clearing and settlement mechanism of BSE.
- The Eligible Shareholders will have to ensure that they keep the depository participant ("DP") account active and unblocked to receive credit in case of return of Equity Shares, due to rejection or due to non-acceptance.
- Excess demat Equity Shares or unaccepted demat Equity Shares, if any, tendered by the Eligible Shareholders would be returned to them by Clearing Corporation.
- Excess or unaccepted Equity Shares which are in physical form, if any, tendered by the Eligible Shareholders would be returned back to the concerned Eligible Shareholders directly by the Registrar to the Buyback. The Company is authorized to split the share certificate and issue new consolidated share certificate for the unaccepted Equity Shares in physical form, in case the Equity Shares accepted by the Company are less than the Equity Shares that are tendered.
- The settlements of fund obligation for Equity Shares in dematerialized and physical form shall be affected as per the SEBI Circulars and as prescribed by the Designated Stock Exchange and Clearing Corporation from time to time and the Seller Member would issue contract note. Company's Broker would also issue a contract note to the Company for the Equity Shares accepted under the Buyback. For Equity Shares in dematerialized form accepted under the Buyback, such beneficial owners will receive funds payout in their bank account as provided by the depository system directly to the Clearing Corporation. For Equity Shares in physical form, the Clearing Corporation will release the funds to the Seller Member(s) as per secondary market payout mechanism. If such shareholders' bank account details are not available or if the funds transfer instruction is rejected by the RBI / bank(s), due to any reason, then the amount payable to the concerned shareholders will be transferred to the Seller Member for onward transfer to such shareholders. The Seller Member would issue contract note, Company's Broker would also issue a contract note to the Company for the Equity Shares accepted under the Buyback.
- Eligible Shareholders who intend to participate in the Buyback should consult their respective Seller Member for payment to them of any cost, applicable taxes, charges and expenses (including brokerage) that may be levied by the Seller Member upon the Eligible Shareholders for tendering Equity Shares in the Buyback (secondary market transaction). The Buyback consideration received by the Eligible Shareholders, in respect of accepted Equity Shares, could be net of such costs, applicable taxes, charges and expenses (including brokerage) and the Company accepts no responsibility to bear or pay such additional cost, charges and expenses (including brokerage) incurred solely by the Eligible Shareholders.
- The Equity Shares lying to the credit of the Special Demat Account and the Equity Shares bought back and accepted in physical form will be extinguished in the manner and following the procedure prescribed in the Buyback Regulations.

14. REJECTION CRITERIA:

The equity shares tendered by the eligible shareholders would be liable to be rejected on the following grounds:

- the shareholder is not an eligible shareholder of the company as on record date; or
- if there is a name mismatch in the dematerialized account of the shareholder and PAN; or
- receipt of completed tender form and other documents but non receipt of equity shares in the special account of the clearing corporation.

15. RECORD DATE AND SHAREHOLDER'S ENTITLEMENT:

As required under 9(i) of the SEBI Buyback Regulations, the Company has announced Friday, April 22, 2022 as the record date (the "Record Date") for the purpose of determining the entitlement and the names of the shareholders, who are eligible to participate in the Buyback Offer.

15.2 The equity shares to be bought back as a part of this Buyback Offer is divided into two categories:

- Reserved category for Small Shareholders; and
- General category for all other shareholders.

15.3 As defined in Regulation 2(i)(n) of the SEBI Buyback Regulations, a "small shareholder" means a shareholder of a company, who holds shares or other specified securities whose market value on the basis of closing price of shares or other specified securities, on the recognized stock exchange in which highest trading volume in respect of such securities, as on record date is not more than two lakh rupees. Presently the equity shares of the Company are not traded on the CSE, thus the closing price for the same is not available. Hence, a shareholder who holds equity shares having market value on the basis of Buyback Offer Price of Rs. 30/- is not more than Rs. 2,00,000 (Rupees Two Lakhs Only) is considered for determination of Small Shareholders in terms of the SEBI Buyback Regulations. However, if on the Record Date the Closing price on the CSE would be available, then the same shall be considered for determination of Small Shareholders in terms of the SEBI Buyback Regulations.

15.4 In accordance with Regulation 6 of the SEBI Buyback Regulations, 15% (fifteen percent) of the number of equity shares which the Company proposes to buyback or number of equity shares entitled as per the shareholding of small shareholders, whichever is higher, shall be reserved for the small shareholders as part of this Buyback.

15.5 On the basis of shareholdings as on the Record Date, the Company will determine the entitlement of each shareholder to tender their shares in the Buyback. This entitlement for each shareholder will be calculated based on the number of equity shares held by the respective shareholder as on the Record Date and the ratio of Buyback applicable in the category to which such shareholder belongs. The final number of equity shares the Company will purchase from the shareholders will be based on the equity shares tendered. Accordingly the Company may not purchase all of the equity shares tendered by the shareholders over and above their entitlement.

15.6 After accepting equity shares tendered on the basis of entitlement, the equity shares left to be bought back if any in one category shall first be accepted, in proportion to the equity shares tendered over and above the entitlement in the offer by the shareholders in that category and thereafter from shareholders who have tendered over and above their entitlement in other category.

15.7 In order to ensure that the same shareholders with multiple demat accounts/ folios do not receive a higher entitlement under the Small Shareholder category, the Company will club together the Equity Shares held by such shareholders with a common PAN for determining the category (Small Shareholder or General Category) and the Buyback Entitlement. In case of joint shareholding, the Company will club together the Equity Shares held in cases where the sequence of the PANs of the joint shareholders is identical. In case of shareholders holding Physical Shares, where the sequence of PANs is identical and where the PANs of all joint shareholders are not available, the Company will check the sequence of the names of the joint holders and club together the Equity Shares held in such cases where the sequence of the PANs and name of joint shareholders are identical. The shareholding of institutional investors like mutual funds, pension funds/ trusts, insurance companies, foreign institutional investors/ foreign portfolio investors etc., with common PAN will not be clubbed together for determining the category and will be considered separately, where these Equity Shares are held for different schemes/sub-accounts and have a different demat account nomenclature based on information prepared by the Registrar to the Buyback as per the shareholder records received from the Depositories. Further, the Equity Shares held under the category of "clearing members" or "corporate body margin account" or "corporate body - broker" as per the beneficial position data as on Record Date with common PAN are not proposed to be clubbed together for determining their entitlement and will be considered separately, where these Equity Shares are assumed to be held on behalf of clients.

15.8 Participation in the Buyback shall be voluntary. Eligible Shareholders of the Company shall have the option to participate, in part or in full and get cash in lieu of equity shares to be accepted under the Buyback or they may choose not to participate and be benefited from a resultant increase in their percentage shareholding in the Company post Buyback without additional investment. Further, Eligible Shareholders of the Company shall have the option of tendering additional Equity Shares (over and above their entitlement) and participate in the shortfall due to non-participation by some other Eligible Shareholders of the Company, if at all.

15.9 The maximum tender under the Buyback by any Eligible Shareholder of the Company cannot exceed the number of Equity shares held by such Eligible Shareholder of the Company as on the Record Date.

15.10 The Equity shares tendered as per the entitlement by the Eligible Shareholders of the Company as well as additional Equity shares tendered, if any, will be accepted as per the procedure laid down in Buyback Regulations.

15.11 Detailed instructions for participation in the Buyback (tendering of Equity shares in the Buyback) as well as the relevant time table will be included in the letter of offer which will be sent in due course to the Eligible Shareholders of the Company.

16. COMPANY SECRETARY & COMPLIANCE OFFICER:

Ms. Sangeeta Roy
Company Secretary
AKC Steel Industries Limited
'Lansdowne Towers', 4th Floor, 2/1A, Sarat Bose Road, Kolkata - 700 020
Tel. No.: (033) 4060 4444, Fax: (033) 2283 3322
E-mail: contact@akcsteel.com; Website: www.akcsteel.com

Investor may contact the Company Secretary for any clarification or to address their grievances, if any, during office hours i.e. 11:00 A.M. to 2:00 P.M. on all working days except Saturday, Sunday and public holidays.

17. INVESTOR SERVICE CENTRE & REGISTRAR TO THE OFFER:

In case of any query, the shareholders may contact the Registrar to the Buyback during office hours i.e. 11:00 A.M. to 2:00 P.M. on all working days except Saturday, Sunday and public holidays.

MAHESHWARI DATAMATICS PRIVATE LIMITED
CIN: U20227WB1982PTC034886
SEBI REG. NO. INR000000353
Validity: Permanent
Contact Person: Mr. Ravi Bahi, Compliance Officer
23, R.N. Mukherjee Road, (5th Floor), Kolkata - 700 001
Tel.: +91 33 2248 2248; Fax: +91 33 2248 4787
Email: mdpldc@yahoo.com; Website: www.mdpl.in

18. MANAGER TO THE BUYBACK OFFER:

SKP SECURITIES LIMITED
CIN: L7410WB1990PLC049032
SEBI REG. NO. INM000012670
Validity: Permanent
Contact Person: Mr. Anup Kumar Sharma
Address: Chatterjee International Centre, Level 21,
33A, Jawaharalal Nehru Road, Kolkata - 700071
Tel.: +91 33 40077000; Email: contact@skpsecurities.com; Website: www.skpsecurities.com

19. DIRECTORS RESPONSIBILITY:

As per Regulation 24(i)(a) of the SEBI Buyback Regulations, the Board of Directors of the Company accept responsibility for the information contained in this Public Announcement or any other information, advertisement, circular, brochure, publicity materials etc. which may be issued in relation to the Buyback and confirms that such documents contain true, factual and material information and does not contain any misleading information.

For and on behalf of the Board of Directors of AKC Steel Industries Limited

Sd/- Ashok Kumar Bansal Whole time Director DIN: 00283193	Sd/- Manav Bansal Director DIN: 00103024	Sd/- Sangeeta Roy Company Secretary Membership No. A37232
---	--	---

Date: 08.04.2022 Place: Kolkata

STOVEC INDUSTRIES LIMITED
Regd. Office: N.I.D.C., Nr. Lambha Village, Post: Narol, Ahmedabad, Gujarat - 382405.
Tel: +91 (0) 79 6157 2300, Fax: +91 (0) 79 2571 0406,
E-mail: secretarial@stovec.com, CIN : L45200GJ1973PLC050790, Website: www.stovec.com.

NOTICE OF 48th ANNUAL GENERAL MEETING

NOTICE is hereby given that the 48th Annual General Meeting ("AGM") of Stovec Industries Limited ("the Company") will be held on Friday, 6th May, 2022 at 2.00 p.m. through video conferencing/other audio-visual means (VC/OAVM) in accordance with the provision of the Companies Act, 2013 ("the Act") and rules made thereunder read with General Circular No. 21/2021 dated December 14, 2021 which permitted companies to hold their AGM through VC/OAVM following the procedures as prescribed under MCA Circular No. 20/2020 dated May 05, 2020 (collectively referred as "MCA Circulars") without the physical presence of the members. In compliance of MCA Circulars and the relevant provisions of the Companies Act, 2013, the 48th AGM of the members of the Company will be held through VC/OAVM to transact the businesses as set forth in the Notice of said AGM.

In accordance with the provisions of Section 101 and 136 of the Act read with MCA Circulars, the full Annual Report of the Company for the year 2021 including notice thereof is being sent by email to those members whose e-mail addresses are registered with the Company/Depositories and physical copy to those such members, who have not registered their e-mail address at their registered address in the permitted mode. The full Annual Report is available on the website of the Company, stock exchange and Central Depository Services (India) Limited (CDSL) at www.stovec.com, www.bseindia.com, and www.evotingindia.com respectively. Member can attend and participate in the AGM virtually and they shall be counted for the purpose of reckoning the quorum as per section 103 of the Act.

In terms of Sections 108 of the Act read with relevant rules and MCA Circulars and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("the Listing Regulations"), the Company is providing facility to its members to cast their votes electronically through the e-voting services of CDSL at www.evotingindia.com through remote e-voting and also during the meeting. The members are requested to note that remote e-voting will commence from 9:00 A.M. on May 03, 2022, and end on 5:00 P.M. May 5, 2022, and once the votes are cast by member, the member shall not be allowed to change it subsequently. The remote e-voting will not be allowed beyond the aforesaid date and time, and e-voting module shall be disabled by CDSL for voting thereafter. The detailed procedure of casting vote through remote e-voting and voting at the meeting has been provided in the notice. Members whose name is recorded in the register of members or in the register of beneficiary owners maintained by the depositories as on the cut-off date of April 29, 2022, may cast their vote electronically on all the business/resolutions set forth in the Notice of 48th AGM. A member may participate in the general meeting even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the meeting. A person who has acquired shares after dispatch of notice of AGM and holding shares as on cut-off date, may cast his/her vote by following the instructions for e-voting as provided in the notice of the AGM.

Manner of registering/updating e-mail address:

- Members holding shares in physical mode, who have not registered/updated their e-mail address with the Company / RTA, may update the same by providing necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to the RTA and/or the Company at ahmedabad@linkintime.co.in and secretarial@stovec.com respectively.
- Members holding shares in Demat mode, who have not registered/updated their e-mail address, are requested to register / update the same with the depository participant(s), where demat accounts are maintained.

Manner of e-voting:

Members can cast their vote(s) electronically remotely or during the meeting on the businesses as set out in the Notice of the AGM. The manner of voting for members holding shares either in demat or physical and who have not registered their e-mail addresses, have been provided in the notes to the Notice of AGM.

The Company has extended the facility of electronic credit of dividend directly to the respective bank account of the members. In order to receive dividend without any delay, the members who are holding share in physical, are requested to submit particulars of their bank account in form ISR-1 alongwith original cancelled cheque bearing the name of member to RTA / Company. The members holding share in demat mode, are requested to update their bank account details with their DPs.

Pursuant to Section 91 of the Act and Regulation 42 of the Listing Regulations, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from April 30, 2022 to May 6, 2022 (both days inclusive) for the purpose of AGM and payment of Dividend, if approved by members at the AGM for the financial year 2021.

In case of any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com under help section or write an email to helpdesk.evoting@cdslindia.com. The official designated to address the grievances in this regard will be Mr. Rakesh Dalvi, Manager and can be contacted at helpdesk.evoting@cdslindia.com or at toll free no. 1800 22 55 33.

Members are requested to carefully read the Notice of the AGM and in particular, instructions for joining the AGM, manner of casting vote electronically.

By Order of the Board of Directors
For **Stovec Industries Limited**,

Place : Ahmedabad
Date : April 11, 2022

Sd/-
Sanjeev Singh Sangar
Company Secretary
Membership No. FCS 7835

VIKAS ECOTECH LTD

Registered Office: 34/1, Vikas Apartment, East Punjabi Bagh New Delhi-110026, India
Tel: 011-43144444
Contact Person: Mr. Prashant Sajwani, Company Secretary and Compliance Officer.
E-mail: cs@vikasecotech.com; Website: www.vikasecotech.com;
Corporate Identification Number: L65999DL1984PLC019465

FIRST REMINDER FOR FIRST AND FINAL CALL - VIKAS ECOTECH LIMITED

Dear Shareholder,
SUBJECT: NOTICE IN RELATION TO PARTLY PAID EQUITY SHARES OF VIKAS ECOTECH LIMITED (THE COMPANY) ON RIGHTS BASIS, PURSUANT TO THE LETTER OF OFFER DATED NOVEMBER 20, 2021 (LETTER OF OFFER OR LOF) ON WHICH THE SHAREHOLDERS HAVE FAILED TO PAY THE FIRST AND FINAL CALL

With reference to our LOF dated November 20, 2021 in relation to the payment of first and final call amount of INR 0.80 per equity share (consisting of face value of INR 0.50/- and a premium of INR 0.30/- per equity share) being first and final call in respect of 30,90,09,241 partly paid-up equity shares of the Company allotted pursuant to Right Issue on December 29, 2021 and having ISIN : IN9806A01010 (Partly Paid-up Equity Shares).

The successful and valid call money was received on 29.55.67.595 Partly Paid Up Equity Shares representing around 95.65% of the amount due on First and Final Call and consequently transition of 29,55,67,595 Partly Paid-Up Equity Shares in to fully paid-up equity shares was approved on March 7, 2020 and 1,34,41,646 Partly Paid-up Shares remained unpaid First and Final Call Money. The Right Issue Committee ("Committee"), duly authorized by the Board of Directors of the Company approved sending of a 1st Reminder Notice for payment of First and Final Call amount of Rs. 0.80/- per partly-up equity share to the holders of such partly paid-up equity shares on which the First and Final Call remains unpaid on April 4, 2022.

Payment Period	From	To	Duration
	April 11, 2022	April 25, 2022	15 days

Mode of Payment: Cheque/Demand Draft payable to "VIKAS ECOTECH LIMITED - FIRST CALL REMINDER COLLECTION A/C".

For Vikas Ecotech Limited
Prashant Sajwani
Company Secretary

Place: Delhi
Date: April 8, 2022

Nippon India Mutual Fund
Wealth sets you free

Nippon Life India Asset Management Limited
(CIN - L65910MH1995PLC220793)
Registered Office: 4th Floor, Tower A, Peninsula Business Park,
Ganapatrao Kadam Marg, Lower Parel (W), Mumbai - 400 013.
Tel.No. +91 22 6808 7000 • Fax No. +91 22 6808 7097 • mf.nipponindiaim.com

NOTICE NO. 07

Hosting of Half-yearly Statement of Scheme Portfolio of Nippon India Mutual Fund

Unitholders of the schemes of Nippon India Mutual Fund ("NIMF") are requested to note that pursuant to Regulation 59A of SEBI (Mutual Funds) Regulations, 1996 read with SEBI Circular no. SEBI/HO/JMD/DF2/CIR/P/2018/92 dated March 05, 2018, the Half-yearly Statement of the Scheme Portfolio of NIMF as on March 31, 2022, have been hosted on the website of NIMF viz., mf.nipponindiaim.com and AMFI viz., www.amfiindia.com. Investors can also request for physical or electronic copy of the Half Yearly Statement of Scheme Portfolio through any of the below modes, free of cost:

- SMS: Type HR <PAN Number> from your registered Mobile Number and send it to 9664001111.
- For example: HR TMRWZ0951U
- Email: customer@nipponindiaim.in
- Customer Care: 18602660111 (charges applicable)
- Investors can reach out to any of the branches of NIMF or written request letter can be sent at KFin Technologies Limited (Unit: Nippon India Mutual Fund) Selenium Building, Tower B, Plot Nos. 31 & 32, Financial District, Nanakramguda, Serilingampally Mandal, Hyderabad - 500 032, Telangana, India.

For NIPPON LIFE INDIA ASSET MANAGEMENT LIMITED
(Asset Management Company for Nippon India Mutual Fund)

Sd/-
Authorised Signatory

Mumbai
April 10, 2022

Make even idle money work! Invest in Mutual Funds
Mutual Fund investments are subject to market risks,
read all scheme related documents carefully.

Business Standard
AHMEDABAD EDITION

Printed and Published by Himanshu S Patwa on behalf of Business Standard Private Limited and printed at MS Bhaskar Printing Press, Survey No 148-P, Near Nagdevta Mandir, Bavla Highway, Sanand Dist. Ahmedabad and published at Business Standard Private Limited, C/o. Regus, Ratnagar 9 Square, No.1109, 11th Floor, Block-A, Keshavnagar, Vastapur, Ahmedabad - 380015.

Editor : Shailesh Dobhal

RNI NO. GUJENG/2001/4577

Readers should write their feedback at feedback@bsmail.in
Ph. 079-26577772, Fax : +91-79-26577728

For Subscription and Circulation enquiries please contact:
Ms. Mansi Singh
Head-Customer Relations
Business Standard Private Limited,
H/4 & 13, Building H, Paragon Centre, Opp. Birla Centurion, P.B.Marg, Worli, Mumbai - 400013
E-mail: subs_bs@bsmail.in
or sms, REACHBS TO 57575

DISCLAIMER News reports and feature articles in Business Standard seek to present an unbiased picture of developments in the markets, the corporate world and the government. Actual developments can turn out to be different owing to circumstances beyond Business Standard's control and knowledge. Business Standard does not take any responsibility for investment or business decisions taken by readers on the basis of reports and articles published in the newspaper. Readers are expected to form their own judgement. Business Standard does not associate itself with or stand by the contents of any of the advertisements accepted in good faith and published by it. Any claim related to the advertisements should be directed to the advertisers concerned. Unless explicitly stated otherwise, all rights reserved by Ms. Business Standard Pvt. Ltd. Any printing, publication, reproduction, transmission or dissemination of the contents, in any form or by any means, is prohibited without the prior written consent of Ms. Business Standard Pvt. Ltd. Any such prohibited and unauthorized act by any person/legal entity shall invite civil and criminal liabilities.

No Air Surcharge

Raymond
LIMITED

(CIN: L17117MH1925PLC001208)
Registered Office: Plot No. 156/H. No. 2, Village Zadoagan, Ratnagiri - 415612, Maharashtra
Website: www.raymond.in | Email ID: corp.secretarial@raymond.in

NOTICE

Transfer of Dividend & Equity shares of the Company to Investor Education and Protection Fund Demat Account

(Pursuant to Section 124(6) of the Companies Act, 2013 ("the Act") and Rule 6 of Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund), Rules, 2016 ("the Rules"))

Notice is hereby given that equity shares of Raymond Limited ("the Company") in respect of which dividend has not been paid or claimed by the Shareholders for seven (7) consecutive years or more shall be transferred by the Company to Investor Education and Protection Fund ("IEPF") Demat Account. The last date for claiming Dividend for the Financial Year 2014-15 is July 14, 2022. The Company has sent individual communication to the concerned shareholders (at their registered address) who have not claimed their dividend amount for the Financial Year 2014-15 and all subsequent years and consequently whose shares are liable to be transferred to IEPF Demat Account. These details are also available on the Company's website www.raymond.in.

No claim shall lie against the Company in respect of such equity shares post their transfer to IEPF Demat Account. Upon transfer, the shareholders will be able to claim these equity shares and any benefit accruing on such shares only from the IEPF Authority by making an online application, the details of which are available at www.iepf.gov.in.

For any clarifications, the concerned shareholders may contact the Company's Registrar & Transfer Agent: Link Intime India Private Limited by quoting their Registered Folio Number or DP ID - Client ID on Tel. No. 022 49186270 or by sending an e-mail to mt.helpdesk@linkintime.co.in. All written communication can be addressed to Link Intime India Private Limited, Unit: Raymond Limited, C-101, 247 Park, LBS Marg, Vikhroli (West), Mumbai - 400083.

For Raymond Limited
Rakesh Darji
Sd/-
Director-Secretarial & Company Secretary

Place: Thane
Date: April 09, 2022

